

Seat No. : _____

FB-03
Chemistry-I
(New Course)

Time : 3 Hours]

[Total Marks : 70

- સૂચના : (1) ઉત્તર સ્પષ્ટ અને ટૂંકમાં લખો.
(2) દરેક પ્રશ્નના ગુણ સરખા છે.
(3) જમણી બાજુએ દર્શાવેલ અંક પ્રશ્નના પૂરા ગુણ દર્શાવે છે.
(4) ઉત્તર-પત્રિકામાં પ્રશ્નક્રમાંક સાચો લખવો.

I. (અ) બેના જવાબ આપો. (5)

- (1) કિર્યોફનું સમીકરણ મેળવો.
(2) ઉષ્મા ગતિશાસ્ત્રના બીજા નિયમનું વિવિધ વિધાનોમાં નિવેદન કરો.
(3) 350°K તાપમાને 2 મોલ વાયુનું સમતાપી પ્રતીવર્તી પ્રસરણ થતાં કદ 200 મી.લી થી 400 મી.લી. બને ત્યારે થયેલ કાર્ય ગણો.
($R = 1.987$ કેલરી ડીગ્રી⁻¹ મોલ⁻¹)

(બ) એકનો જવાબ આપો. (4)

- (1) પ્રક્રિયા ક્રમ અને આણ્વીકતા એટલે શું ? આભાસી એક આણ્વીક પ્રક્રિયા સમજાવો.
(2) પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા સમાન હોય ($a = b$) તેવી દ્વિતીય ક્રમની પ્રક્રિયા 35% પૂર્ણ થવા 12 મીનટનો સમય લાગે છે. પ્રક્રિયા 65% પૂર્ણ થવા લાગતો સમય ગણો.

(ક) એકનો જવાબ આપો. (5)

- (1) વાયુના અનુવર્તી અવસ્થાના નિયમ પર નોંધ લખો.
(2) વાયુના પ્રવાહીકરણની વિવિધ પદ્ધતિઓના સિધ્ધાંત ચર્ચો.

II. (અ) બેના જવાબ આપો. (10)

- (1) આંતર આયનીક આકર્ષણ સિધ્ધાંત સમજાવો.
(2) ક્ષારનું જલવિભાજન એટલે શું ? નિર્બળ એસીડ અને પ્રબળ બેઈઝમાંથી મળતા ક્ષારના જલીય દ્રાવણ માટે જલ વિભાજન અચળાંક અને pH માટેનું સૂત્ર તારવો.
(3) બફર દ્રાવણ એટલે શું ? તેમની લાક્ષણિકતાઓ જણાવો. બફર વિસ્તાર અને બફર ક્ષમતા સમજાવો.
(4) પદ સમજાવો – તુલ્યવાહકતા, અણુવાહકતા, વિશિષ્ટ રોધકતા.

FB-03

1

P.T.O.

- (બ) એક ગણો (4)
- (1) જો 0.001 N NaNO_3 ની તુલ્યવાહકતા 118 મહોસ-સે.મી.² હોય તો નીચેની વિગતો પરથી 0.001 N HNO_3 ની તુલ્યવાહકતા અને કોષ અચળાંક શોધો.
- 0.001 N HCl અને $R_{\text{HCl}} = 630$ ઓહમ્સ
0.001 N NaNO_3 અને $R_{\text{NaNO}_3} = 2050$ ઓહમ્સ
0.001 N NaCl અને $R_{\text{NaCl}} = 2080$ ઓહમ્સ
- (2) પ્રતિલીટરે 24 ગ્રામ CH_3COOH અને 1.64 ગ્રામ CH_3COONa ધરાવતા બફર દ્રાવણ pH ગણો. CH_3COOH નો $K_a = 1.80 \times 10^{-5}$ છે.
- III. (અ) બેના જવાબ આપો. (7)
- (1) ફજાન, રસેલ, સોડીનો સમૂહ સ્થાનાંતરનો નિયમ સમજાવો.
(2) કેન્દ્રીય ગલન (Nuclear Fusion) પર નોંધ લખો.
(3) ${}^8\text{O}^{16}$ માટે કેન્દ્રીય ત્રિજ્યા અને પેક પ્રમાણ ગણો.
($O = 16.01470$ $R_o = 1.3$ f)
- (બ) બેના જવાબ આપો. (7)
- (1) ψ અને ψ^2 નું અર્થઘટન સમજાવો.
(2) આઈગન વિધેય અને આઈગન મૂલ્ય પર નોંધ લખો.
(3) કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમોની ટૂંકમાં સમજૂતી આપો.
- IV. ત્રણના જવાબ આપો. (14)
- (અ) સિજવીક-પોવેલના સિધ્ધાંત આધારે નીચેના અણુઓના આકાર સમજાવો.
(1) ClF_3 અને (2) IF_7
- (બ) લેટાઇસ શક્તિ એટલે શું ? KF સ્ફટિક માટે બોર્ન-હેબર ચક્ર દોરો અને સમજાવો.
(ક) પ્રમાણ (stoichiometric) સંયોજનોની ખામીઓ ચર્ચો.
(ડ) અર્ધવાહકો પર નોંધ લખો.
(ઈ) sp^3 અને sp^3d સંકરણની યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
- V. (અ) બેના જવાબ આપો. (8)
- (1) સંકીર્ણની સ્થિરતાને અસર કરતા પરીબળો ચર્ચો.
(2) $[\text{Fe}(\text{CN})_6]^{4-}$ આંતઃકક્ષીય સંકીર્ણ છે જ્યારે $[\text{Fe}(\text{H}_2\text{O})_6]^{+2}$ બાહ્યકક્ષીય સંકીર્ણ છે – સમજાવો.
(3) અષ્ટ ફલકીય સંકીર્ણમાં સ્ફટિકક્ષેત્ર વિભાજન સમજાવો.
(4) સંકીર્ણ સંયોજનો માટેનો વર્નર સિધ્ધાંત સમજાવો.
- (બ) એકનો જવાબ આપો. (6)
- (1) ઝીંક ધાતુ મેળવવાની કાર્બન રીડકશન પદ્ધતિ સમજાવો.
(2) ડાય બોરેન બનાવવાની રીત લખો અને ડાયબોરેનમાંના બંધની સમજૂતી આપો.

Seat No. : _____

FB-03
Chemistry-I
(New Course)

Time : 3 Hours]

[Total Marks : 70

- Instructions :**
- (1) Write short and precise answer.
 - (2) Each question carries equal marks.
 - (3) Figures on the right indicate full marks.
 - (4) Write correct number of question in answer book.

I. (a) Answer **Two** : **(5)**

- (1) Derive Kirchoff's equation.
- (2) Give various statements of second law of thermodynamics.
- (3) Volume increases from 200 ml. to 400 ml. when 2 moles of a gas expands isothermally and reversibly at 350°K. Calculate work done in the process. ($R = 1.987 \text{ cal. degree}^{-1}\text{mole}^{-1}$)

(b) Answer **One** : **(4)**

- (1) What is order of a reaction and molecularity ? Explain pseudo monomolecular reaction.
- (2) A second order reaction with equal initial concentration of both reactants ($a = b$) is 35% completed in 12 minutes. Calculate time taken for 65% completion of this reaction.

(c) Answer **One** : **(5)**

- (1) Write a note on the law of corresponding states of a gas.
- (2) Discuss the principles of various methods of liquification of gases.

II. (a) Answer **Two** : **(10)**

- (1) Explain inter ionic attraction theory.
- (2) What is hydrolysis of salt? Derive an expression for hydrolysis constant and pH of an aqueous solution of a salt obtained from weak acid and strong base.
- (3) What is buffer solution ? State its characteristics. Explain buffer range and buffer capacity.
- (4) Explain the terms – Equivalent conductance, molar conductance and specific resistance.

(b) Calculate **one** : (4)

(1) If equivalent conductance of 0.001 N NaNO_3 is 118 mhos-cm², calculate equivalent conductance of 0.001 N HNO_3 and cell constant from the following data :

For 0.001 N HCl $R_{\text{HCl}} = 630$ ohms
0.001 N NaNO_3 $R_{\text{NaNO}_3} = 2050$ ohms
0.001 N NaCl $R_{\text{NaCl}} = 2080$ ohms

(2) Buffer solution containing 24 grams CH_3COOH and 1.64 gram CH_3COONa per litre. Calculate pH of the solution. K_a for CH_3COOH is 1.80×10^{-5} .

III. (a) Answer **Two** : (7)

(1) Explain Fajan, Russell, Soddy's group displacement law.
(2) Write a note on Nuclear Fusion.
(3) Calculate radius of nucleus and packing fraction for ${}^8\text{O}^{16}$.
($O = 16.01470$ $R_o = 1.3f$)

(b) Answer **Two** : (7)

(1) Explain significance of ψ and ψ^2 .
(2) Write a note on eigen function and eigen value.
(3) Explain in short the rules for the arrangement of electrons in orbitals.

IV. Answer **Three** : (14)

(a) Explain shapes of the following molecules on the basis of Sidgwick-Powell theory :
(1) ClF_3 (2) IF_7
(b) What is lattice energy ? Draw and explain Born-Haber cycle for KF crystal.
(c) Discuss the defects of stoichiometric compounds.
(d) Write a note on semiconductors.
(e) Discuss sp^3 and sp^3d hybridization with suitable examples.

V. (a) Answer **Two** : (8)

(1) Discuss the factors effecting the stability of complex salts.
(2) $[\text{Fe}(\text{CN})_6]^{-4}$ is inner orbital complex while $[\text{Fe}(\text{H}_2\text{O})_6]^{+2}$ is an outer orbital complex. Explain.
(3) Explain crystal field splitting in octahedral complex.
(4) Explain Werner's theory for complex salts.

(b) Answer **One** : (6)

(1) Describe carbon reduction method for the extraction of Zinc metal.
(2) State and write method of preparation of diborane and explain bonding in diborane molecule.

Seat No. : _____

FB-03
Chemistry-I
(Old Course)

Time : 3 Hours]

[Total Marks : 70

- સૂચના : (1) ઉત્તર સ્પષ્ટ અને ટૂંકમાં લખો.
(2) દરેક પ્રશ્નના ગુણ સરખા છે.
(3) જમણી બાજુએ દર્શાવેલ અંક પ્રશ્નના પૂરા ગુણ દર્શાવે છે.
(4) ઉત્તર-પત્રિકામાં પ્રશ્નક્રમાંક સાચો લખવો.

1. (અ) એકનો જવાબ આપો. (5)

- (1) જૂલ થોમસન અસર પર નોંધ લખો.
(2) બંધનશક્તિ અને સસ્પેન્ડન શક્તિની વ્યાખ્યા આપો અને કોઈ એક સમજાવો.

અથવા

- (2) 0°C તાપમાને 9 ગ્રામ બરફનું પાણીમાં રૂપાંતર થાય છે તો એન્ટ્રોપી ફેરફાર ગણો.
(બરફની ગલન ગુપ્ત ઉષ્મા 80 કેલરી/ગ્રામ)

(બ) એકનો જવાબ આપો. (4)

- (1) પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા સમાન હોય (a = b) તેવી દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક માટેનું સૂત્ર તારવો.
(2) પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની કોઈ એક રીત સમજાવો.

(ક) એકનો જવાબ આપો. (5)

- (1) વાયુનો અણુભાર નક્કી કરવાની સિમાંત ઘનતાની રીત વર્ણવો.
(2) 1 મોલ CO₂ માટે વાન્ડરવાલના અચળાંકો (લીટર-વાતાવરણમાં a = 3.6 અને b = 4.28 × 10⁻² છે. વાયુનું ક્રાંતિ ઉષ્ણતામાન અને કદ શોધો. (R = 0.082 લીટર-વાતાવરણ ડી.ગ્રી⁻¹ મોલ⁻¹ છે)

2. ત્રણના જવાબ આપો. (14)

- (અ) ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ અને તેની મર્યાદાઓ સમજાવો.
(બ) પ્રબળ એસીડ અને નિર્બળ બેઈઝમાંથી મળતા ક્ષારના જલીય દ્રાવણ માટે જલવિભાજન અચળાંક અને pHના સૂત્રો તારવો.
(ક) પદ સમજાવો - કોષ અચળાંક, તુલ્યવાહકતા, વિશિષ્ટ વાહકતા

- (ડ) 150 મી.લી. 0.2 M CH_3COOH અને 100 ml 0.2 M NaOH મિશ્ર કરતાં મળતા દ્રાવણનું pH ગણો. (CH_3COOH નો $K_a = 1.82 \times 10^{-5}$ છે.)
- (ઘ) અનંત મંદતાએ NH_4OH ના દ્રાવણની તુલ્યવાહકતા ગણો.
 $\lambda_{\infty}(\text{NH}_4\text{Cl}) = 149.74$ $\lambda_{\infty}\text{NaOH} = 248.11$
 $\lambda_{\infty}(\text{NaCl}) = 126.45$
3. (અ) બેના જવાબ આપો. (7)
- (1) સોડીનો સમૂહ સ્થાનાંતરનો નિયમ સમજાવો.
(2) કેન્દ્રીય ખંડન (Nuclear fission) પર નોંધ લખો.
(3) ${}^2\text{He}^4$ નું પેક પ્રમાણ શોધો. (He નું આઇસોટોપીક દળ = 4.00387)
- (બ) બેના જવાબ આપો. (7)
- (1) તરંગ વિધેય ψ અને ψ^2 નું અર્થઘટન સમજાવો.
(2) સમાનીકૃત અને ઓર્થોગોનલ તરંગ વિધેયો સમજાવો.
(3) પોલીનો નિષેધ સિધ્ધાંત સમજાવો.
4. ત્રણના જવાબ આપો. (14)
- (અ) લેટાઇસ શક્તિ એટલે શું ? NaCl સ્ફટિક માટે બોર્ન-હાબર ચક્ર દોરો અને સમજાવો.
(બ) sp^2 અને sp^3 સંકરણની યોગ્ય ઉદાહરણ આપી ચર્ચા કરો.
(ક) અર્ધવાહકો પર નોંધ લખો.
(ડ) નીચેના અણુના આકાર સમજાવો.
(1) NH_3 (2) SF_6
(ઘ) બીન પ્રમાણ સંયોજનોમાં ધાતુના અધિકમથી અને ઉણપથી ઉદ્ભવતી ખામીઓ ચર્ચો.
5. (અ) બેના જવાબ આપો. (10)
- (1) સંકીર્ણ ક્ષાર માટેનો વર્નર સિધ્ધાંત સમજાવો.
(2) સંકીર્ણ ક્ષારોમાં સમઘટકતા પર નોંધ લખો.
(3) $[\text{NiF}_4]^{-2}$ અને $[\text{Ni}(\text{CN})_4]^{-2}$ ના બંધારણ અને ચુંબકીય ગુણ ચર્ચો.
(4) ક્વિલેટ સંયોજનો પર નોંધ લખો.
- (બ) એકનો જવાબ આપો. (4)
- (1) આર્જેન્ટીફેરસ લેડમાંથી સીલ્વર મેળવવાની પાર્કની રીત સમજાવો.
(2) ઈલેક્ટ્રોપ્લેટીંગ પર નોંધ લખો.

Seat No. : _____

FB-03
Chemistry-I
(Old Course)

Time : 3 Hours]

[Total Marks : 70

- Instructions :**
- (1) Write short and precise answer.
 - (2) Each question carries equal marks.
 - (3) Figures on the right indicates full marks.
 - (4) Write correct number of question in answer book.

I. (a) Answer **One** : **(5)**

- (1) Write a note on Joule-Thomson effect.
- (2) Define Bond energy and Resonance energy. Explain any one of them.

OR

- (2) Calculate entropy change when 9 gms of ice is converted into water at 0°C.
(Latent heat of fusion for ice is 80 cal./gm.)

(b) Answer **One** : **(4)**

- (1) Derive an expression for the rate constant of second order reaction with equal initial concentration ($a = b$) of both reactants.
- (2) Explain any one method for determining order of reaction.

(c) Answer **One** : **(5)**

- (1) Describe limiting density method to determine molecular weight of a gas.
- (2) For 1 mole CO_2 gas Van-der Waal's constants (in litre-atmosphere) are $a = 3.6$ and $b = 4.28 \times 10^{-2}$. Calculate critical temperature and volume of the gas.

II. Answer **Three** : **(14)**

- (a) Explain Ostwald's dilution law and its limitations.
- (b) Derive an expression for hydrolysis constant and pH for the aqueous solution of a salt obtained from strong acid and weak base.
- (c) Explain the terms – Cell constant, Equivalent conductance, Specific conductance.

(d) Calculate pH of a solution, when 150 ml. 0.2 M CH_3COOH and 100 ml. 0.2 M NaOH are mixed. (K_a for $\text{CH}_3\text{COOH} = 1.82 \times 10^{-5}$).

(e) Calculate equivalent conductance of NH_4OH at infinite dilution.

$$\lambda_{\infty(\text{NH}_4\text{Cl})} = 149.74$$

$$\lambda_{\infty(\text{NaOH})} = 248.11$$

$$\lambda_{\infty(\text{NaCl})} = 126.45$$

III. (a) Answer **Two** : (7)

(1) Explain Soddy's group displacement law.

(2) Write a note on Nuclear Fission.

(3) Calculate packing fraction for ${}^4_2\text{He}$.

(Isotopic mass for He is 4.00387)

(b) Answer **Two** : (7)

(1) Explain significance of wave function ψ and ψ^2 .

(2) Explain normalized and orthogonal wave function.

(3) Explain Pauli's exclusion principle.

IV. Answer **Three** : (14)

(a) What is lattice energy ? Draw and explain Born-Haber cycle for NaCl crystal.

(b) Discuss sp^2 and sp^3 hybridization with suitable examples.

(c) Write a note on semiconductors.

(d) Explain shapes of the following molecules :

(1) NH_3 (2) SF_6

(e) Explain non-stoichiometric defect due to the metal excess and deficiency of metal.

V. (a) Answer **Two** : (10)

(1) Explain Werner's principle for complex salts.

(2) Write a note on isomerism in complex salts.

(3) Discuss structure and magnetic properties of $[\text{NiF}_4]^{-2}$ and $[\text{Ni}(\text{CN})_4]^{-2}$.

(4) Write a note on chelate compounds.

(b) Answer **One** : (4)

(1) Explain Parke's method for extraction of silver from argentiferous lead.

(2) Write a note on Electroplating.